ARDI INVESTMENT AND TRADING CO LTD

Regd off: Shop No. 3 Hemu Castle, Dadabhai Road, Near Gokhlibai School Vile Parle (W) Mumbai-400056, Maharashtra CIN: L65923MH1981PLC024912

Website: www.ardi.co.in Email id: compliancingardi@gmail.com

Date: 13.02.2023

To, The Corporate Relations Department BSE Limited PJ Towers, 25th floor, Dalal Street, Mumbai - 400 001

<u>Sub: Submission of copies of Newspaper Advertisement pursuant to Regulation 47 of</u> the SEBI (LODR) Regulations, 2015

Ref. Ardi Investment & Trading Co Limited (Scrip Code: 504370)

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of financial results of the Company for the quarter ended 31st December, 2022 published in the following newspapers dated on 13th February, 2023:

- 1. Business Standard (English)
- 2. Jai Hind (Gujarati)

Kindly take the information on record and oblige.

Thanking you,

Yours faithfully,

For, ARDI INVESTMENT AND TRADING LTD

Gautam Digitally signed by Gautam Pravincha Pravinchandra Sheth Pravinchandra Sheth Date: 2023.02.13 ndra Sheth 11:34:14 +05'30'

Gautam Sheth Managing Director (DIN: 06748854)

	FOR THE QUARTER ENDED ON	DECEMBER 31, 2022			(RS. III Lakiis)			
Sr. No	Particulars	Quarter ended 31-12-2022 Unaudited	9 Months ended 31-12-2022 Unaudited	9 Months ended 31-12-2021 Unaudited	Half Year ended 30-09-2022 Unaudited	Half Year ended 30-09-2021 Unaudited	Year ended 31-03-2022 Audited	
1 2 3 4 5 6 7	Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs. 10/- each) Basic & Diluted	16.06 16.06 16.06 40.00 4.02	16.44 13.11 13.11 40.00 3.28	0.75 -10.06 -10.06 40.00 -2.52	-0.38 -3.71 -3.71 40.00 	0.14 -7.27 -7.27 40.00 	-40.91 -51.73 -51.73 40.00 	

Notes: (1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meetings held on February 11, 2023. (2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended on December 31, 2022 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (3) The above is an extract of the detailed format of Quarterly Financial Results filled with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same is available on the websites of the Stock Exchange and the listed entity. (4) Previous periods figures have been regrouped / reclassified where considered necessary to conform to current period's classification. to conform to current period's classification. For and on behalf of Ardi Investment and Trading Co. Limited sd/- Gautam Sheth, Managing Director, DIN: 06748854 Place: Ahmedabad II Date: 11/02/2023

Aadhar Housing Finance Ltd.

Corporate Office: Unit No. 802. Natrai Rustomiee. Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069



Bhavnagar Branch: No.313, At 3rd Floor, Shopper Plaza, Waghadi Road, Bhavnagar-364002,(GJ)

Jamnagar Branch: 3rd Floor, Madhav Plaza, Opp. SBI, Lal Bunglow Circle, Jamnagar - 361001,(GJ) Junagadh Branch: Shop No.201 to 203, 2nd Floor, Merigold-2, Opposite Bahaudin College Road, Junagadh-362001, (GJ) Naroda Branch: 3rd Floor, City Center Arcade & Home, Near SRP Camp, Krishna Nagar - Naroda Road, Naroda, Ahmedabad-382345 GJ

Surat Branch: Office No. 209 & 210, 2nd Floor, Universal Business Center, Near Madhuvan Circle, L.P. Savani Road Adaian, Surat-395009 GJ

Surat Parvat Patiya Branch: Shop No. - 115 & 116, 1St Floor, Times Square, Opp. Dm Landmark, Textile Market, Parvat Pativa, Magob, Surat - 395010, (GJ)

DEMAND NOTICE

UNDER SECTION 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH RULE 3 (1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 The undersigned is the Authorised Officer of Aadhar Housing Finance Ltd (AHFL) under Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 (the said Act). In exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorised Officer has issued Demand Notices under section 13(2) of the said Act, calling upon the following Borrower(s) (the "said Borrower(s)"), to repay the amounts mentioned in the respective Demand Notice(s) issued to them that are also given below. In connection with above, Notice is hereby given, once again, to the said Borrower(s)to pay to AHFL, within 60 days from the publication of this Notice, the amounts indicated herein below, together with further interest as detailed in the said Demand Notice(s), from the date(s) mentioned below till the date of payment and/or realization, payable under the loan agreement read with other documents/writings, if any, executed by the said Borrower(s). As security for due repayment of the loan, the following assets have been mortgaged to AHFL by the said Borrower(s) respectively

hav	e been mortgaged to AHFL by the said Borrower(s)	respectively.	
S. No.	Name of the Borrower / Co-Borrower & Guarantor	Demand Notice Date & Amount	Description of secured assets (immovable property)
1	(Loan Code No. 0410000820 / Bhavnagar Branch) Hanifmeeya Jafarmeeya Baharuni (Borrower) Shahenaz Hanifmiya Baharuni (Co-Borrower)	11-02-2023 ₹ 6,99,132/-	All that piece and parcel of property bearing, R S No. 207 P Fatema Society Plot No 10 Paiki North Side Block No 1 Fatema Society opp Masjid Ae Hussaini St Road, Bhavnagar, Gujarat, 364290
2	(Loan Code No. 04110000142 / Bhavnagar Branch) Kishorbhai Ladhabhai Bhil (Borrower) Vasantben Kishorbhai Bhil (Co-Borrower)	11-02-2023 ₹ 9,98,560/-	All that piece and parcel of property bearing, Moon Light Society Parekh Collage Road NA Plot No.205 Paiki Mahuva Bhavnagar Gujarat 364290,
3	(Loan Code No. 1290000792 / Jamnagar Branch) Nazia Iqbal Juneja (Borrower) Rizwan Iqbalbhai Juneja (Co-Borrower)	11-02-2023 ₹ 10,40,745/-	All that piece and parcel of property bearing, R S NO 467 468 1 Kaushal Nagar Kaushal Nagar sub Plot No 2 9 6 4 Nr Patel Samaj Hapa Marketing Road, Jamnagar , Gujarat, 361001.
4	(Loan Code No.10800000237/Junagadh Branch) Polabhai Ramabhai Parmar (Borrower) Ritaben Polaben Parmar (Co-Borrower) Hardik Vallbhbhai Rajkotiya (Guarantor)	11-02-2023 ₹ 4,88,973/-	All that piece and parcel of property bearing, 321 1 322 1 Plot No 22 South Side Madhav Nagar Jay Vagheshwari Maa Maliya Main Road, Nr. Maliya Government Hospital, Junagadh, Gujarat, 362245
5	(Loan Code No.1080000854/Junagadh Branch) Radhaben Ratilal Rudatala (Borrower) Ratilal Bhikhabhai Rudatala (Co-Borrower) Pareshbhai Prabhudas Suba (Guarantor)	11-02-2023 ₹ 93,859/-	All that piece and parcel of property bearing, 186 2 P 2 Plot No 26 p North Side Block No 10 Dwarkadhish Residency Amar Gadh Maliya Road, Junagadh, Gujarat, 362245
6	(Loan Code No.17210000087/Naroda Branch) Ilyaskhan Pathan (Borrower) Yasmin Elyaskhan Pathan (Co-Borrower)	11-02-2023 ₹ 15,63,999/-	All that piece and parcel of property bearing, Flat No. C-A/15 3rd Floor, United Appartment Co.Op Housing Society Sarkhej - Ahmedabad Road Moje Maktumpura Ahmadabad, Gujarat, 380055
7	(Loan Code No.04200001159/Surat Branch) Late.Kuldip Jaglal Maurya (Represented Through The Legal Heir) (Borrower) Akhileshkumar Maurya (Co-Borrower) Sonukumar B Thakur (Guarantor)	11-02-2023 ₹ 5,84,513/-	All that piece and parcel of property bearing, Block No 1 1 Flat No 405 4th Floor Shree Radha Madav Residency Datta Krupa 2 Nr Gram Panchayat Office Vareli, Surat, Gujarat, 394140
8	(Loan Code No.04200001378/Surat Branch) Dharmendra Kumar Heeralal (Borrower) Manju Devi (Co-Borrower) Arun Kumar Devata Deen (Guarantor)	11-02-2023 ₹ 3,47,820/-	All that piece and parcel of property bearing, New Block No 2 Flat No 304 3rd Floor Swastik Residency 2 Sonipark Housing Soc 2 Bs Sahaj Anand Resi Tatithaiya, Surat, Gujarat, 394305
9	(Loan Code No.04210000101/Surat Branch) Bhavesh Mansukhbhai Jethva (Borrower) Jayashriben Mansukhbhai Jethwa (Co-Borrower)	11-02-2023 ₹ 7,73,170/-	All that piece and parcel of property bearing, B-301 3rd Floor Parth Residency B/S. DGVCL office O.P. No-93, P.No-1 to 3, 15 to 20 Surat Gujarat, 394107
10	(Loan Code No. 12300000716 / Surat Parvat Patiya Branch) Punakidevi Chatraram (Borrower) Chatraram Savaram (Co-Borrower) Vithalbhai Dahyabhai Dobariya (Guarantor)	11-02-2023 ₹ 2,29,981/-	All that piece and parcel of property bearing, Block No 122 Paiki 1 Flat No A 591 50 A 591 51 4th Floor Patel Township Nr. Ranchodrai Temple Lane Velanja Shekhpur Road, Surat, Gujarat, 394150
11	(Loan Code No. 12300001469 / Surat Parvat Patiya Branch) Jitendra Kumar (Borrower) Kunta (Co-Borrower)	11-02-2023 ₹ 7,83,066/-	All that piece and parcel of property bearing, R S No 133 Block No 137 A HI Kailash Niwas Flat No 402 4th Floor Kailash Niwas Plot No A 43 A 44 opp Sarjan Resi Harihant Park Soc Kadodara, Surat, Gujarat,

If the said Borrowers shall fail to make payment to AHFL as aforesaid. AHFL shall proceed against the above secured assets under Section 13(4) of the Act and the applicable Rules, entirely at the risks of the said Borrowers as to the costs and consequences. The said Borrowers are prohibited under the Act from transferring the aforesaid assets, whether by way of sale. lease or otherwise without the prior written consent of AHFL. Any person who contravenes or abets contravention of the provisions of the said Act or Rules made there under, shall be liable for imprisonment and/or penalty as provided under the Act.

394327

: 12th February, 2023

Dinesh Kistur Rayal (Guarantor)

Sd/- Authorised Officer Place : Guiarat For: Aadhar Housing Finance Limited Date : 13.02.2023

TAYO ROLLS LIMITED

Corporate Identity No.: L27105JH1968PLC000818 Registered office: 3, Circuit House Area (North-East), Road No.11, Bistupur, Jamshedpur-831 001, INDIA

	(₹ In Lakhs								
c			Quarter Ende	i	Nine Mon	ths Ended	Year Ended		
Sr. No.	Particulars Particulars	31.12.2022	30.09.2022	31.12.2021	31.12.2022	31.12.2021	31.03.2022		
IVU.		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited		
1	Total income	-				-	-		
2	(Loss) for the period (Before tax and exceptional items)	(87)	(87)	(88)	(261)	(262)	(347)		
3	(Loss) for the period after tax (After exceptional items)	(87)	(87)	(88)	(261)	(262)	(347)		
4	Other comprehensive income / (loss) for the period	-	-	-	-	-	-		
5	Total comprehensive (loss) for the period	(87)	(87)	(88)	(261)	(262)	(347)		
6	Equity share capital	1,026	1,026	1,026	1,026	1,026	1,026		
7	Other equity	-		-	-	-	(49,095)		
8	Paid-up equity share capital (Face value : ₹ 10/- per share)	-	-	-	-	-	-		
	Basic:	(0.85)	(0.84)	(0.85)	(2.55)	(2.55)	(3.39)		
	Diluted:	(0.85)	(0.84)	(0.85)	(2.55)	(2.55)	(3.39)		

The above is an extract of the detailed format of Quarterly / Nine Months / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the

The Board of Directors had referred the Company to the Board for Industrial and Financial Reconstruction (BIFR) as required under the First proviso of section 15 (I) of The Sick Industrial Companies (Special Provisions) Act, 1985 and the Company is registered with BIFR on 23rd March, 2016. Meanwhile, the Ministry Finance issued Notifications S. O. 3568 (E) & S. O. 3569 (E) dated 25th November, 2016 to the effect that SICA has been repealed with effect from 1rd December 2016 and all the references or inquiry pending before the BIFR and / or AAIFR shall stand abated. The Board of Directors at their meeting held on 3rd July 2017 ha ecided to refer the Company to the Honorable National Company Law Tribunal (NCLT) Bench Kolkata under Section 10 of the Insolvency and Bankruptcy Coo 2016 (IBC) for initiation of Corporate Insolvency Resolution Process (CIRP). Subsequently, on 13th July, 2017, the Company has filed relevant application befo the Honorable NCLT Bench, Kolkata under Section 10 of the Insolvency and Bankruptcy Code, 2016. The Workers of the Company, in the capacity of operation creditor had also filed an application before the Honorable Tribunal Kolkata under Section 9 of the Insolvency and Bankruptcy Code (IBC), 2016 seeking initiation of CIRP. Both appeals were rejected by the Tribunal. The Company and the workers had separately filed appeal before the Honorable National Company La unal against the rejection order passed by the Honorable Tribunal. The Honorable Appellate Tribunal allowed the appeal filed by the Company a

the Workers. However, it has directed the Tribunal at Kolkata to admit the appeal filed by the Workers. The Corporate insolvency Resolution Process (CIRP) has been initiated against the Company vide an order passed by Honorable NCLI Kolkata dated 05.04.20!!
Pursuant to this order, the powers of the Board of Directors stands suspended and were exercisable by Mrs. Vinita Agrawal, the Interim Resolution Professional (IRP) appointed by the Honorable NCLT Bench. Kolkata who was consequently confirmed to continue as the Resolution Professional (IRP) by the nittee of Creditors (CoC). Consequent to the petition filed by COC, the Honorable NCLT Bench, Kolkata, passed an order on 30th October, 2019 and appo Mr. Anish Agarwal (IP Registration No.: IBBI/IPA-001/IP-P-01497/2018-2019/12256) as Resolution Professional in place of Mrs. Vinita Agrawal (the erstwi

The Company has incurred a loss of ₹ 87.00 Lakhs during the quarter ended on 31st December, 2022 and accumulated losses as on reporting date ₹ 54.898.20 Lakhs. The net worth of the Company has already been eroded and the Company's current liabilities exceeded its current assets

The income earned and expenses incurred during CIRP period for the nine month ended on 31st December 2022 have not been considered in the Fin Statement as these income and expenditures are not regular business transactions of the corporate debtor and these CIRP expenditures are payable l

Resolution Applicant as per Section 30(2) or in case of liquidation the same will be paid from the liquidation proceeds as per Section 53 of the IBC, 2016. The Company is not in operation since September, 2016. A resolution plan submitted by JSEB / JBVNL (one of COC members) for revival of the company w had been approved by COC and filed with Honorable NCLT Bench. Kolkata for its approval on 24.02.2020. However, unless the same is approved, the position the company will not undergo a drastic favorable change. Considering, these factors the going concern assumption is not appropriate for preparing the IND A financial statements and these IND AS financial statements have been prepared other than going concern basis.

For TAYO ROLLS LIMITED (CA Anish Agarwal) Resolution Professiona



SHIVA MILLS LIMITED

Regd. Office: 252, METTUPALAYAM ROAD, COIMBATORE 641 043 CIN: L17111TZ2015PLC022007 Website: www.shivamills.com

EXTRACT OF THE DETAILED FORMAT OF QUARTERLY/NINE MONTHS ENDED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31.12.2022 FILED WITH STOCK EXCHANGES UNDER REGULATION 33 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE **REQUIREMENTS) REGULATIONS 2015.**

SI. No.	PARTICULARS	Quarter ended 31.12.2022 (Unaudited)	Quarter ended 31.12.2021 (Unaudited)	9 Months ended 31.12.2022 (Unaudited)	9 Months ended 31.12.2021 (Unaudited)
1.	Total Income from Operations	3,215.25	5,890.44	12,206.34	14,905.88
2.	Net Profit/(Loss) for the period before Tax, Exceptional and/or Extraordinary items	(590.48)	540.31	(561.81)	1,714.76
3.	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(590.48)	540.31	(561.81)	1,714.76
4.	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(547.04)	399.87	(526.21)	1,260.34
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after Tax) and other Comprehensive Income (after Tax)	(541.99)	397.81	(511.06)	1,254.18
6.	Equity Share Capaital	864.18	864.18	864.18	864.18
7.	Earnings per Share (of Rs.10 each) (for continuing and discontinued operations) i) Basic ii) Diluted	(6.33) (6.33)	4.63 4.63	(6.09) (6.09)	14.58 14.58
Notes		<u> </u>	<u> </u>		

l) The full format of the quarterly financial results are available on the Stock Exchanges websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.shivamills.com

2) Previous period/year figures have been regrouped wherever necessary

FOR SHIVA MILLS LIMITED

PLACE: COIMBATORE DATE : 11.02.2023

S V ALAGAPPAN MANAGING DIRECTOR

PUBLIC NOTICE

NOTICE is hereby given that 1. Sh. Shyamji (Shyamlal) Vallabhbhai Rathod & 2. Girishbhai Vallabhbhai Rathod (hereinafter referred to as the said Mortgagor/Borrower) have created mortgage in respect of the Property more particularly described in the Schedule hereunder in favour of my/our client IDFC First Bank Limited, 212 to 214, 2nd Floor, nternational Business Centre, Piplod Main Road, Beside Big Bazar, Surat – 395017, Guiarat That, the said below mentioned property i.e. Plot No. 224 belongs to (1) Mangiben Vallabhbha Rathod, (2) Shyamlal Vallabhbhai Rathod & (3) Girishbhai Vallabhbhai Rathod amongst them Mangiben Vallabhbhai Rathod expired on 11/01/2015, whereby her Legal Heirs Viz; (1) Niruben Hasmukhbhai Rathod & Dio Vallabhbhai Rathod, (2) Kanjibhai Vallabhbhai Rathod, (3) Chandubhai Vallabhbhai Rathod, (4) Sumitraben alias Tasnim Firoz Patangwala & Dio Vallabhbhai Rathod, (5) Taraben Rameshbhai Bariya & Dío Vallabhbhai Rathod, (6) Kokilaben Shaileshbhai Nayaka & Dío Vallabhbhai Rathod, (9) Durgaben Dineshbhai Rathod & Dío Vallabhbhai Rathod succeeded her title of ownership thereto.

Thereafter (1) Niruben Hasmukhbhai Rathod & D/o Vallabhbhai Rathod, (2) Kanjibha Vallabhbhai Rathod, (3) Chandubhai Vallabhbhai Rathod, (4) Sumitraben alias Tasnim Firos Patangwala & D/o Vallabhbhai Rathod, (5) Taraben Rameshbhai Bariya & D/o Vallabhbha Rathod, (6) Kokilaben Shaileshbhai Nayaka & D/o Vallabhbhai Rathod, (7) Durgabe Dineshbhai Rathod & Dio Vallabhbhai Rathod have released their 1/3 share paikee 7/9 Undivided share in respect of said Plot No. 224 in favour of "1. Sh. Shyamji (Shyamlal) Vallabhbhai Rathod & 2. Girishbhai Vallabhbhai Rathod" through a Release Deed Without Valiabilibila Radio & 2. Girishbhai Vallabhbhai Rathod & 2. Girishbhai Vallabhbhai Vallabhbhai Vallabhbhai Rathod & 2. Girishbhai Vallabhbhai Vallabhbhai Vallabhbhai Vallabhbhai Vallabhbhai V

legal heirs of the said property.

Further mentioned that, according to the said Mortgagor/Borrower, original document namely, 1. Registration Receipt of Sale Deed Reg. No. 30, dated 02/01/1991, 2. Sale Deed Reg. No. 1881, dated 07/02/1990 & it's Registration Receipt, 3. Sale Deed Reg. No. 2451, dated 16/06/1970 & it's Registration Receipt have been lost/ misplaced and not

If any person, body, individual, institution having any claim and /or objection in respect of o against or relating to or touching upon said property by way of sale, lease, lien, mortgage, charge, encumbrance, gift, easement, maintenance, inheritance, testamentary deposition or otherwise or having in their custody any title, documents pertaining the said Property shall communicate the same to the undersigned at my address within 7 days from the publication of this notice with documentary evidence in support thereof, failing which all the claim, of such person shall be considered to have been waived and or abandoned. Any objections raise after the completion of the 7 days shall not be binding upon the said Property or my Client.

THE SCHDEDULE ABOVE REFERRED TO

All that piece and parcel of the Immovable Property, bearing Plot No. 224 admeasuring 12 X 33 Feet i.e. 44 sq. yard i.e. 36.78 sq. mts., Along with 306 sq. feet Construction, Situate at Old Survey No. 15/1 Paiki New Revenue Survey No. 158/1 Paiki Ward No. 34, T. P. Scheme No. 4 (Umra South), Final Plot 130, of Moje Panas (Now Umra), City of Surat.

209, 2nd Floor, Dalal Chambers, Bejanji Kotwal Street, Nanpura, Surat. Mo : 99247 29776 99741 79252

Advocate

OLYMPIC OIL INDUSTRIES LTD

Regd.Office: 709, C Wing, One BKC, Near Indian Oil Petrol Pump, G Block, BKC, Bandra (East), Mumbai - 400051 CIN: L15141MH1980PLC022912 Email: olympicoilltd@gmail.com Website: www.olympicoil.co.in Tel: 022-6249 4444 Fax: 02226520906

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2022

(₹ in Lakhs except EPS)

Particulars	Quarter	Nine Months	Quarter
	ended	ended	Ended
	31.12.2022	31.12.2022	31.12.2021
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total income from Operations	-	1.43	1.26
Net Profit/(Loss) for the period	(12.98)	(36.60)	(11.35)
(before Tax, Exceptional and/or Extraordinary items)			
Net Profit/(Loss) for the period before tax	(12.98)	(36.60)	(11.35)
(after Exceptional and/or Extraordinary items)			
Net Profit/(Loss) for the period after tax	(12.98)	(36.60)	(11.35)
(after Exceptional and/or Extraordinary items)			
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)	(12.98)	(36.60)	(11.35)
for the period (after tax) and other Comprehensive Income (after tax)]			
Equity Share Capital	285.40	285.40	285.40
Reserves (excluding Revaluation Reserves)	-	-	-
Earning Per Share (of ₹10/- each) (for continuing and discontinued			
operations)-			
1. Basic:	(0.45)	(1.28)	(0.40)
2. Diluted:	(0.45)	(1.28)	(0.40)
Note: The above is an extract of the detailed format of unaudited standa	lone Financial	Results of the	Company for

the quarter and nine months ended 31st December, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results are available on the website of the Company i.e. www.olympicoil.co.in and on the website of Stock Exchange i.e www.bseindia.com

For and behalf of the Board

Place : Mumbai Date: 11th February, 2023 Whole-time Directo DIN: 02923423 ADITYA BIRLA ADITYA BIRLA HOUSING FINANCE LIMITED

APPENDIX IV[See Rule 8 (1) of the Security Interest (Enforcement) Rules, 2002] Possession Notice (for Immovable Property)

Whereas the undersigned being the authorized officer of Aditya Birla Housing Finance Limited under the Securitization and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of pow ers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interes (Enforcement) Rules, 2002 issued a Demand notice Dated 12.05.2021 calling upon the borrowers namely Jyoti Rajanikantbhai Patel, Rajnikantbhai N Patel to repay the amount mentioned in the notice being Rs. 29,68,704/- (Rupees wenty Nine Lakh(s) Sixty Eight Thousand Seven Hundred Four And Paise Twenty Four Only) within 60 days from the date of receipt of the said notice

he borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken Possession o the property described herein below in exercise of the powers conferred on him/he inder Section 13(4) of the said act read with rul8 the Security Interest (Enforcement Rules, 2002 on this 10th Day of Feb of the year 2023.
The borrowers in particular and the public in general is hereby cautioned not to dea

with the property and any dealings with the property will be subject to the charge of the Aditya Birla Housing Finance Limited for an amount of Rs. 29,68,704/-(Rupees Twenty Nine Lakh(s) Sixty Eight Thousand Seven Hundred Four And Paise Twenty Four Only) and interest thereon. The borrowers attention is invited to the provisions of sub-section 8 of Section 13 of the act, in respect of time available,

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY All that part and parcel of the property consisting of situated at Plot No- A/ 16 ,Omkar

Residency Vibhag- 1 ,Rs No- 214- A- 10, Block No- 529, Tps No- 41, Op No- 30, Fp No- 30/ Á & 30/ B, Pre Tps Fp No- 30/ B, New Fp No- 49, Nr- Mahaprabhunaga Society, Nr- Cng Pump, Udhna- Dindoli Road, Navagam, Dindoli, Surat- 394210 Dindoli B.O, Surat, Gujarat, India - 394210.

Date: 10/02/2023 Authorised Office Aditya Birla Housing Finance Limited Place: Surat



Balrampur Chini Mills Limited

Regd. Office: FMC Fortuna, 2nd floor, 234/3A, A.J.C. Bose Road, Kolkata - 700020 CIN - L15421WB1975PLC030118, Phone No. (033) 22874749, Fax No. (033) 22892633 E-mail: bcml@bcml.in Website: www.chini.com

Extract of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Nine months ended 31-12-2022

(₹ In lakhs except EPS data

				Standalone					Consolidate	d	
SI. No.	Particulars	3 months ended 31-12-2022 [Unaudited]	Corresponding 3 months ended 31-12-2021 in the previous year [Unaudited]	9 months ended 31-12-2022 [Unaudited]	Corresponding 9 months ended 31-12-2021 in the previous year [Unaudited]	Year ended 31-03-2022 [Audited]	3 months ended 31-12-2022 [Unaudited]	Corresponding 3 months ended 31-12-2021 in the previous year [Unaudited]	9 months ended 31-12-2022 [Unaudited]	Corresponding 9 months ended 31-12-2021 in the previous year [Unaudited]	Year ended 31-03-2022 [Audited]
1)	Total Income from operations	98,115.53	1,21,215.16	3,17,433.50	3,56,642.16	4,84,602.68	98,115.53	1,21,215.16	3,17,433.50	3,56,642.16	4,84,602.68
2)	Net Profit/(Loss) for the period/year										
	(before tax and exceptional items)	6,108.46	9,458.96	3,762.46	29,627.06	60,287.54	6,353.54	8,549.90	4,411.71	29,425.31	59,992.07
3)	Net Profit/(Loss) for the period/year										
	(before tax) (after exceptional items)	6,108.46	9,458.96	3,762.46	29,627.06	65,561.29	6,353.54	8,549.90	4,411.71	29,425.31	59,871.70
4)	Net Profit/(Loss) for the period/year										
	after tax (after exceptional items)	4,440.75	7,109.84	2,474.02	22,570.17	51,465.77	4,628.73	6,412.56	2,972.02	22,415.42	46,463.55
5)	Total comprehensive income for the	4,440.75	7,118.83	1,695.80	22,594.09	51,103.98	4,628.73	6,421.21	2,193.80	22,439.04	46,096.53
	period / year [comprising Profit for										
	the period / year (after tax) and other										
	comprehensive income (after tax)]										
6)	Equity Share Capital	2,039.75	2,040.40	2,039.75	2,040.40	2,040.40	2,039.75	2,040.40	2,039.75	2,040.40	2,040.40
7)	Other equity					273775.70 (As at 31-03-2022)					274930.95 (As at 31-03-2022)
8)	Earnings per share										
	(Face value of ₹1/- each)										
	(not annualised for quarter and nine										
	months figures)										
	Basic and Diluted (₹)	2.18	3.48	1.21	10.85	24.86	2.27	3.14	1.46	10.78	22.44

Notes:

1) The above is an extract of the detailed Quarter and Nine months ended Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

The complete Quarter and Nine months ended Unaudited Financial Results are available on the Stock Exchange website, i.e. (www.nseindia.com /www.bseindia.com) and Company's website (www.chini.com).

2) The Board of Directors has declared an interim dividend of ₹2.50 (250%) per Equity Share of ₹1/- each.

3) The consolidated financial results for previous periods up to 31st March, 2022 include results pertaining to two associate companies: Visual Percept Solar Projects Pvt. Ltd (VPSPPL) and Auxilo Finserve Pvt. Ltd. (AFPL). VPSPPL ceased to be an associate with effect from 15th February, 2022.

4) The Board of Directors at its meeting held on 9th November, 2022 has approved the buy-back of equity shares not exceeding ₹ 14544.00 lakhs ("Maximum Buyback Size", excluding transaction costs and tax on buy-back) at a price not exceeding ₹ 360/- per Equity share (" Maximum Buyback Price"). At the Maximum Buyback Price and the Maximum Buyback Size, the indicative maximum number of Equity Shares to be bought back works out to 40,40,000 Equity Shares ("Maximum Buyback Shares"), which represent approximately 1.98% of the paid-up share capital of the Company as at 31st March, 2022.

The buy-back, which has been offered to the equity shareholders of the Company (other than the Promoters, the Promoter Group and Persons in Control of the Company) under the open market route through the stock exchanges, has commenced on 16th November, 2022 and 4,55,723 equity shares have since (up to 10th February, 2023) been bought back by the Company. This includes 64,746 equity shares bought back during the quarter ended 31st December, 2022.

5) Sugar being a seasonal industry, the performance of the Company varies from quarter to quarter and financial results for the quarter as such are not representative of the annual performance of the Company.

6) The previous periods' figures have been regrouped and rearranged wherever necessary to make them comparable with those of the current periods' figures.

For and on behalf of the Board of Directors of **Balrampur Chini Mills Limited** Vivek Saraogi

Date: 11th February, 2023.

Place of Signature: Kolkata

IBBI/IPA-001/IP-P-01497/2018-2019/12256

Chairman and Managing Director



બિહાર પબ્લિક સર્વિસ કમિશન (બીપીએસસી)ની રવિવારે યોજાયેલી ૬૮મી પ્રીલિમ્સ પરીક્ષા દરમિયાન પટના ખાતેના એક પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને અંદર પ્રવેશ આપતા પહેલા તેમના ડોક્યુમેન્ટસ વેરીફાઈડ કરવામાં આવી રહૃાા છે.

હરિયાણાની સરકારી હોસ્પિટલોમાં હવે ફેશન ચાલશે નહીં

સરકારી હોસ્પિટલ્સમાં જીન્સ,

પ્લાઝો, બેકલેસ ટોપ પર પ્રતિબંધ

નહીં. ત્યાંના ડોક્ટર અને સ્ટાફ માટે જરૂરી છે. જેમાં કર્મચારીનું નામ

આરોગ્ય વિભાગના નવા ડ્રેસ -નર્સિંગ કેડર સિવાય સફેદ શર્ટ

કેશનવાળા કપડા **પુરુષ કર્મચારીઓના વાળ લાંબા** પડતા ખુલ્લા કે

પર પ્રતિબંધ લાગુ **હોવા ન જોઈએ, મહિલાઓ** ચુસ્ત કપડા હોવા કરી દેવાયો છે. જોઈએ નહીં.

જ્વેલરી યુઝ કરી શકશે નહીં

સ્ટાઈલિશ ડ્રેસ, હેવી જ્વેલરી અને કરવાનો અધિકાર સિવિલ સર્જનોને

ગેરહાજર ગણીને કાર્યવાહી પ્લાઝો, એમ્બ્રોઇડરી સૂટ, પજામી

શૉર્ટ્સ, સ્લેક્સ ડ્રેસ, સ્કર્ટ, પ્લાઝો, સ્પોર્ટ્સ કે લોફર શૂઝ, સ્નીકર્સ

સ્ટ્રેચ ટી-શર્ટ અને પેન્ટ, ફિટિંગ પહેરીને આવી રહ્યા હતા. આની

પેન્ટ, કેપરી, હિપ હગર, સ્વેટપેન્ટ, ફરિયાદ સરકારને મળી, જે બાદ

FRESHTROP FRUITS LIMITED

Reg Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER 31ST DECEMBER, 2022

www.freshtrop.com

સ્ટ્રેપલેસ કે બેકલેસ ટોપ, ક્રૉપ ટોપ, આ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે.

- સિક્ચોરિટી, પરિવહન, અમલ કરવો પડશે.

કોઈ રંગનું જીન્સ, ડેનિમ સ્કર્ટ, પહેરીને આવી રહ્યા હતા. ડેનિમ ડ્રેસ, સ્વેટ શર્ટ, સ્વેટ શૂટ, ૃ-પુરુષ સ્ટાફ જીન્સ, ટી

કોડમાં જીન્સ, પ્લાઝો, બેકલેસ અને કાળુ પેન્ટ પહેરી શકાશે.

ડ્રેસ કોડ લાગુ કરી દેવાયો છે. અને પદ હોવુ જરૂરી છે

કર્મચારીઓના વાળ કોલરથી લાંબા ચાલશે નહીં.

હોવા જોઈએ નહીં. મહિલાઓ

મેકઅપ યુઝ કરી શકશે નહીં. નખ

પણ લાંબા ચાલશે નહીં. ડ્રેસ કોડનો

અમલ ન કરનાર સ્ટાફને ડ્યુટી પર

કમર લાઈનથી નાનુ ટોપ, ડીપ નેક

ટોપ, ટેક્ર ટોપ, ઓફ્ર શોલ્ડર બ્લાઉઝ

કે સ્નીકર-સ્લીપર પહેરી શકાશે

Tel: 079 40307050-57

હોસ્પિટલોમાં હવે ફેશન ચાલશે

ટોપ, સ્કર્ટ જેવા

હેરસ્ટાઈલ પણ

નક્કી કરવામાં

આવી છે. પુરુષ

કરવામાં આવશે.

. હરિયાણા, તા.૧૨ સફાઈ અને રસોઈ કર્મચારી

સરકારી પોતાની વર્દીમાં હોવા જરૂરી છે.

સ્ટાઈલિશ ડ્રેસ અને હેવી અસામાન્ય હેર

આપવામાં આવ્યો છે

- હોસ્પિટલ સ્ટાફ માટે નેમ પ્લેટ

સ્ટાઈલ કે હેર

- ડ્રેસ કોડ માટે કલર નક્કી

ડ્રેસ કોડ લાગુ કરવાના ૨ કારણ

- મહિલા સ્ટાફ ડ્રેસના બદલે

ટોપ, શૉર્ટ કુર્તી અને ચુસ્ત કપડા

- પુરુષ સ્ટાફ જીન્સ, ટી-શર્ટ,

હરિયાણા સરકારના આ આદેશ

તમામ કર્મચારીઓ પર લાગુ થશે.

હોસ્પિટલ સ્ટાફમાં રેગ્યુલર સાથે

કોન્ટાક્ટ કર્મચારીઓને પણ આનો

(0.73

1.48

યુવકની હત્યા બદલ પિતા-પુત્રને 39 વર્ષે આજીવન કેદ લખીમપુર ખીરીમાં સત્માન માટે તેને ગોળી મારીને

એડિશનલ જિલ્લા અને સત્ર જજ સુભાષ સિંહની કોર્ટે ૩૧ વર્ષ પહેલાં તેમના પરિવારની એક છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છતા કૉલેજ સ્ટુડન્ટની હત્યા કરવા બદલ ૭૫ વર્ષીય ખેડૂત અને તેના પર વર્ષીય દીકરાને આજીવન કેદની સજા ફટકારી છે. જો કે, આ ઘટના ૧૯૯૨ની છે અને ગુરુવારે તેનો ચુકાદો આવ્યો હતો. ૧૯ વર્ષીય પીડિત જ્ઞાનેન્દ્ર કુમાર ત્રિપાઠી જે સીતાપુર જિલ્લાની એક કૉલેજમાં ભેંગનો હતો, ખીરીના નીમગાવ વિસ્તારમાં રહેતા પોતાના પરિવાર પાસે જઈ રહ્યો હતો એ સમયે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાદમાં

હત્યા કરી નાખી હતી. પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી સુરેશ ચંદ્ર મિશ્રાએ પોલીસને જણાવ્યું કે, ત્રિપાઠી તેના ઘરમાં લુંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એટલા માટે તેઓએ લાઈસન્સવાળી બંદુકથી તેને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

સિનિયર પ્રોસિક્યુશન ઓફિસર એસપી યાદવે જણાવ્યું કે, મિશ્રા અને તેના પરિવારે દાવો કરીને કેસને વાળવાનો પ્રયાસ કર્યો કે જ્ઞાનેન્દ્રએ કેટલાંક અજાણ્યા લોકો સાથે મળીને તેના ઘરને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને પીડિતના પરિવાર આવે એ પહેલાં જ ફરિયાદ નોંધાવી હતી.

ARDI INVESTMENT AND TRADING CO. LTD CIN: L65923MH1981PLC02491 Shop No. 3, Hemu Castle, Dadabhai Road, Near Gokhlibai School, Vile Parle (W), Mumbai - 400056 E-mail: compliancingardi@gmail.com || Website: www.ardi.co.in || Ph.: 022-28764128 / 26248888 EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS QUARTER FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2022 (Rs. in Lakhs)

Sr. No		Quarter ended 31-12-2022 Unaudited	9 Months ended 31-12-2022 Unaudited	9 Months ended 31-12-2021 Unaudited	Half Year ended 30-09-2022 Unaudited	Half Year ended 30-09-2021 Unaudited	Year ended 31-03-2022 Audited
1	Total Income	16.06	16.44	0.75	-0.38	0.14	-40.91
2	Net Profit for the year before tax	16.06	13.11	-10.06	-3.71	-7.27	-51.73
3	Net Profit for the year after tax	16.06	13.11	-10.06	-3.71	-7.27	-51.73
4	Total Comprehensive Income for the year	**					
5	Paid up Equity Share Capital	40.00	40.00	40.00	40.00	40.00	40.00
6	Other Equity Excluding Revaluation Reserve						
7	Earnings per share (Face Value of Rs.10/- each)						
	Basic & Diluted	4.02	3.28	-2.52	-0.93	-1.82	-12.93

Notes: (1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meetings held on February 11, 2023. (2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended on December 31, 2022 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (3) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same is available on the websites of the Stock Exchange and the listed entity. (4) Previous periods figures have been regrouped / reclassified where considered necessary to conform to current period's classification.

For and on behalf of Ard Investment and Trading Co. Limited sd/- Gautam Sheth, Managing Director, DIN: 06748854

DARSHAN ORNA LIMITED CIN: L36910GJ2011PLC063745 Registered Office: Survey No. 02105+2106/3/ Lawar Ni Pole, Shekh Sariya Chambers, Madan Gopal Haveli Road, Manek Chowk, Ahmedabad-380001

Sr.	Particulars	Quarter	9 Months	9 Months	Half Year	Half Year	Year
No.	raticulais	ended	ended	ended 31-12-2021 Unaudited	ended 30-09-2022 Unaudited	ended 30-09-2021 Unaudited	ended 31-03-2022 Audited
1	Total Income	457.79	1168.30	1000.79	710.51	732.98	1392.81
2	Net Profit for the year before tax	11.44	55.69	83.46	44.23	58.22	87.85
3	Net Profit for the year after tax	8.44	45.89	73.46	37.43	49.72	78.86
4	Total Comprehensive Income for the year						
5	Paid up Equity Share Capital	1,000.59	1,000.59	1,000.59	1,000.59	1,000.59	1,000.59
6	Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each)		-	-			

Notes: (1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meetings held on February 03, 2023. (2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended on December 31, 2022 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (3) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same is available on the websites of the Stock Exchange and the listed entity. (4) Previous periods figures have been regrouped/ reclassified where considered necessary to conform to current period's classification.

For and on behalf of For, Darshan Orna Limited

sd/- Mahendrabhai R. Shah, Director, DIN: 03144827

આધાર હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

કોર્પોરેટ ઓફીસઃ ૮૦૨, નટરાજ રૂસતમજી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એમ.વી. રોડ, અંધેરી(પૂર્વ),

અમદાવાદ શાખા: ઓફીસ નં. ૨૦૪, બીજા માળે, સત્કાર કોમ્પ્લેક્સ, સ્વાગત પાસે, બોડીલાઈન ક્રોસીંગ, સી.જી.રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, ગુજરાત અધિકૃત અધિકારીઃ સચિનકુમાર ગિરીશભાઈ ચોખાવાલા, મોબ. – ૯૪૨૯૦૮૮૬૮૯

લિલામ સહ વેચાણની જાહેર નોટીસ

સિક્યુરાઇટેઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્રસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ આધાર હાઉર્સીંગ ફાયનાન્સ લીમીટેડના અધિકૃત અધિકારી દ્વારા કરજદાર/કરજદારો પાસેથી રકમની વસુલાત માટે અહી નીચે જણાવેલી જામીનગીરીકૃત મિલકતનો કબજો ધારણ કર્યાના અનુસંધાને, અહી નીચે આપેલી વિગતો મુજબ સ્થાવર મિલકત જે ભૌતિક કબજામાં છે અને "જયાં છે ત્યાં' જેવી છે તેવી" અને ''જે છે તે'' ધોરણે મિલકતની ખરીદી માટે મહોરબંધ કવરમાં ઓફર મંગાવવામાં આવે છે.

ક મ	કરજદાર/કરજદારઓ/ જામીનદાર/ જામીનદારો	ડીમાંડ નોટીસની તારીખ અને રકમ	સ્થાવર મિલકતનું વર્ણન	અનામત કિમત	અર્નેસ્ટ મની ડીપોઝીટ (EMD) (આરપીના ૧૦%)
9	(લોન કોડ નં. ૦૩૫૦૦૦૦૦૧૫૯૨/ અમદાવાદ શાખા) છત્રસિંહ રામસિંહ સોલંકી (કરજદાર) લક્ષ્મીબેન છત્રસિંહ સોલંકી (સહ-કરજદાર)	૦૯-૦૨-૨૦૨૨ અને રૂા. ૧૧,૪૯,૪૮૭/-	સીટી સર્વે નં. ૩૦૫૦ ૩૦૪૮ ર સિદ્ધેશ્વરી એપાર્ટમેંટ, ફ્લેટ નં. સી ૧૦૨, પ્રથમ માળ, સિદ્ધેશ્વરી એપાર્ટમેંટ, વિરાજ એપાર્ટમેંટ પાસે, પેથાપુર, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦ની સુવાંગ મિલકત ચતુર્દિશાઃ પૂર્વઃ સીટી સર્વે નં. ૩૦૩૯ ૩૦૪૦, પશ્ચિમઃ સી-૧૦૧, ઉત્તરઃ સીટી સર્વે, દક્ષિણઃ સી-૧૦૩	રૂા. ૧૦,૭૦,૦૦૦/- (રૂ. દસ લાખ સીતેર હજાર ફક્ત)	રૂા. ૧,૦૭,૦૦૦/- (રૂ. એક લાખ સાત હજાર ફક્ત)

(૧) અહી ઉપરોક્ત સરનામે શાખા કાર્યાલયમાં ઈએમડી અને કેવાયસી સાથે નિર્ધારિત ફોર્મમાં મહોરબંધ બોલી/ઓફર રજૂ કરવાની અંતિમ તારીખ ૧૪-૦૩-૨૦૨૩ સાંજના ૫:૦૦ સુધી છે. ટેન્ડર જે ભરવામાં આવેલ નથી તેને અને અંતિમ તારીખ પછી પ્રાપ્ત ટેન્ડરોને અમાન્ય ટેન્ડર ગણવામ આવશે અને તદનુસાર તેનો અસ્વીકાર કરવામાં આવશે. ઇએમડી પર કોઈ વ્યાજ ચુકવવામાં આવશે નહી.

(૨) ઉપરોક્ત શાખા કાર્યાલયે મિલકત માટેની બોલી/ઓફર ખોલવાની તારીખ ૧૫-૦૩-૨૦૨૩ સાંજે ૩:૦૦ વાગે છે. અધિકૃત અધિકારીની હાજરીમાં ટેન્ડરો ખોલવામાં આવશે.

(૩) વેચાણ સમયે હાજર રહેવા માટે કરજદાર/કરજદારો તથા જામીનદારોને આથી નોટીસ આપવામા આવે છે. તેઓ વેચાણની શરતો અને નિયમો

મુજબ ઉપરોક્ત સ્થાવર મિલકતની ખરીદી માટે ઈરાદો ધરાવતા ખરીદારોને લાવી શકે છે. (૪) આ સરફેસી એક્ટ, ૨૦૦૨ હેઠળ ૩૦ દિવસની વેચાલ નોટીસ કરજદાર(રો), સહ-કરજદાર(રો) અને જામીનદાર(રો)ને આપવામાં આવે છે

કે સીક્થોર્ડ કેડીટરને મોર્ટુગેજ/ પ્રભારીત કરવામાં આવેલી છે અને જેનો ભૌતિક કબજો આધાર હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ (એએચએફએલ). સીક્ચોર્ડ ક્રેડીટરના અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવેલ છે તેનું "જ્યાં છે ત્યાં", "જેવી છે તેવી" અને "જે છે તે" ધોરણે મિલકતનું લિલામ કરવામાં આવશે અને અગર કોઈ બેલેન્સ બાકી રહેશે તો વ્યાજ અને ખર્ચાઓ સાથે વસુલ કરવામાં આવશે. અગર કરજદાર વેચાણની તારીખ પહેલાં સંપૂર્ણ ૨કમ ભરપાઈ કરી આપશે તો લિલામ બંધ રહેવાને પાત્ર રહેશે.

(૫) સ્થાવર મિલકતનું વેચાણ સૌથી વધારે ટેન્ડર આપનારને કરવામાં આવશે. જો કે, અધિકૃત અધિકારી, અગર જરૂરી જણાયે, આપસમાં બોલી બોલવાની છૂટ આપવાના તેના અબાધિત વિવેકાધિકારને અનામત રાખે છે. ઉપર જણાવ્યા મુજબ મિલકતનું અનામત કિમતથી નીચી કીમતે વેચાણ કરવામાં આવશે નહી.

(૬) ઉપર જણાવ્યા મુજબની મિલકત પર કોઈપણ અનિર્ણિત જવાબદારીઓ માટે એએચએકએલ જવાબદાર નથી. "જ્યાં છે ત્યાં", ''જેવી છે તેવી" અને ''જે છે તે'' ધોરણે મિલકતનું વેચાણ કરવામા આવશે.

(૭) ડીમાંડ ડ્રાફ્ટ "આધાર હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ"ના નામનો બનાવવાનો રહેશે.

(૮) લીલામી વેચાણની વિગતવાર શરતો અને નિયમો નિર્ધારિત ફોર્મમાં સમાવિષ્ટ કરેલ છે. ટેન્ડર ફોર્મ્સ ઉપરોક્ત શાખા કાર્યાલયે પ્રાપ્ય છે. ટેન્ડરની તારીખ લંબાવવા કે બોલીની શરતો અને નિયમોમાં ફેરફાર કરવા માટેના હક્કોને અધિકૃત અધિકારી અનામત રાખે છે. વધુ વિગતો તથા બોલીની

શરતો અને નિયમો માટે અમારી શાખાની અને વેબસાઈટ www.aadharhousing.com ની મુલાકાત લેવા વિનંતી છે.

વધુ વિગતો માટે ઉપરોક્ત શાખા કાર્યાલયે અધિકૃત અધિકારીનો સંપર્ક સાધવા વિનંતી. સહી/- અધિકૃત અધિકારી સ્થળઃ ગુજરાત

આધાર હાઉસિંગ ફાયનાન્સ લી.

કોર્પોરેટ ઓફીસઃ યુનિટ નં. ૮૦૨, નટરાજ રૂસતમજી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એમ.વી. રોડ, અંધેરી(પૂર્વ),

અમદાવાદ શાખાઃ ઓફીસ નં. ૨૦૪, બીજા માળે, સત્કાર કોમ્પ્લેક્સ, સ્વાગત પાસે, બોડીલાઈન ક્રોસીંગ, સી.જી.રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, ગુજરાત

પરિશિષ્ટ ૪ કબજાની નોટીસ (સ્થાવર મિલકત માટે)

અહી નીચે સહી કરનાર સિક્ચુરાઇટેઝેશન એન્ડ રિકન્સટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફ્રોર્સમેન્ટ ઓફ સિક્ચુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ આધાર હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ (એએચએફએલ)ના અધિકૃત અધિકારી હોવાથી અને સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાયે લેતા ઉક્ત એક્ટની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલી સત્તાનો અમલ કરતા. અહી નીચે જણાવેલ કરજદાર(રો)/સહ-કરજદાર(રો)/જામીનદાર(રો)ને અધિકૃત અધિકારી દ્વારા ડીમાંડ નોટીસ આપવામાં આવી હતી અને અં નોટીસમાં જણાવેલી રકમ કથિત નોટીસની પ્રાપ્તિની તારીખથી ૬૦ દિવસની એંદર ચૂકવી આપવાની સૂચના આપવામાં આવી હતી. ઉધારકત રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, આ દ્વારા કરજદાર(રો)/ જામીનદાર(રો)ને તથા સામાન્ય જનતાને નોટીસ આપવામાં આવે છે કે સિક્શુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ના નિયમ ૮ સાથે વંચાણે લેતા કથિત એક્ટની કલમ ૧૩ની પેટા-કલમ (૪) હેઠળ આપવામાં આવેલી સત્તાની રુએ અહી નીચે સહી કરનાર અધિકારીએ, નીચે વર્શન કર્યા મુજબની મિલકતનો કબજો ધારણ કરેલ છે. જામીનકૃત મિલકતને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રાપ્ય સમયના સંદર્ભમાં કથિત એક્ટની કલમ ૧૩ની પેટાકલમ (૮)ની જોગવાઈઓ પ્રત્યે કરજદારોનું ધ્યોન દોરવામાં આવે છે. વિશિષ્ટ રૂપે કરજદારને અને સામાન્યરીતે જાહેર જનતાને આ મિલકત અંગે કોઈ વ્યવહાર નહી કરવા આથી સુચના આપવામાં આવે છે અને મિલકત અંગેનો કોઈપણ વ્યવહાર, અહી નીચે જણાવેલી ૨કમ અને તેની ઉપરના વ્યાજ સાથેની ૨કમ માટે, એએચએફએલના પ્રભારને

ર્ક મ	કરજદાર(રો)/ સહ- કરજદાર(રો)/ના નામ (શાખાનું નામ)	જામીનગીરી કુત મિલકતનું વર્ણન (સ્થાવર મિલકત)	ડીમાંડનોટીસની તારીખ અને રકમ	કબજાની તારીખ					
વ	(લોન કોડ નં. ૨૯૪૦૦૦૦૨૫૦/અમદાવાદ ચાંદખેડા શાખા) મહેશભાઇ નારણભાઇ પટણી (કરજદાર) દિવ્યાંગ પટણી અને જયોત્સના મહેશભાઇ પટણી (સહ-કરજદાર) પ્રતાપરાય કનેયાલાલ મહેતા (જામીનદાર)	આરએસ નં. ૪૬૦ ન્યુ અભિલાયા એપાર્ટમેંટ ફ્લેટ નં. ૧ ૨ ૩ ન્યુ અભિલાયા એપાર્ટમેંટ પટેલની ચાલ પાસે, બોમ્બે હાઉસિંગની પાછળ, અનિલ સ્ટાર્ચ રોડ, સરસપૂર, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૧૮ની સુવાંગ મિલકત ચતુર્સીમાઃ પૂર્વઃ ફ્લેટ નં. આઈ/૨૧૨, પશ્ચિમઃ એપ્રોચ રોડ ઉત્તરઃ એચ બ્લોક, દક્ષિણઃ ફ્લેટ નં. આઈ ૨૧૪.	૧૨-૧૦-૨૦૨૨ <u>ર</u> ા. ૧૨,૦૧,૮૧૧/-	0८-0२- २०२3					
સ્થ	થળઃ ગુજરાત અધિકૃત અધિકૃતી								

આધાર હાઉસીંગ ફાયનાન્સ લીમીટે

આધાર હાઉસિંગ ફાયનાન્સ લી.

કોર્પોરેટ ઓફીસઃ યુનિટ નં. ૮૦૨, નટરાજ રૂસતમજી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એમ.વી. રોડ, અંધેરી(પૂર્વ),



નરોડા શાખાઃ ૩જો માળ, સીટી સેન્ટર આર્કેડ અને હોમ, એસઆરપી કેમ્પ પાસે, ક્રિશ્રાનગર, નરોડા રોડ, નરોડા, અમદાવાદ-૩૮૨૩૪૫ જીજે

ડીમાંડ નોટીસ

સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ ૨૦૦૨ ના નિયમ ૩(૧) સાથે વંચાણે લેતા સિક્ચોરીટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ મહી નીચે સહી કરનાર, સિક્થોરીટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફ્રોર્સમેન્ટ ઓફ સિક્થોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (કથિત

એક્ટ) ની કલમ ૧૩(૨) હેઠળ આધાર હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડના અધિકૃત અધિકારી છે. સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ ૨૦૦૨ ના નિયમ ૩(૧) સાથે વંચાણે લેતા કથિત એક્ટની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલી સત્તાની રુએ નિમ્નલિખિત કરજદાર(રો) (કથિત કરજદાર(રો)ને તેઓને આપવામાં ત્રાવેલી અને અહી નીચે આપવામાં આવેલી છે તે સંબંધિત ડીમાંડ નોટીસમાં જણાવેલી ૨કમ ચૂકવી આપવા અનુરોધ કરતી ડીમાંડ નોટીસ આપવામાં આવી હતી. ઉપરની બાબત સંબંધે, આ નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી ૬૦ દિવસોની અંદર અહી નીચે જણાવેલી રકમો એએચએફએલને ચૂકવી આપવા કરજદાર(રો)ને ફરી મેકવાર નોટીસ આપવામાં આવે છે. કથિત કરજદાર(રો) દ્વારા લખી આપવામાં આવેલ અન્ય દસ્તાવેજો/લખાણો સાથે વંચાણે લેતા લોન કરાર હેઠળ ચુકવવા પાત્ર ાકમો, નીચે જણાવેલી તારીખ(ખો)થી ચુકવણી અને/અથવા વસુલાતની તારીખ સુધીના વ્યાજ સહિત ડીમાંડ નોટીસમાં જણાવ્યા મુજબની રકમો ચૂકવી આપવા કરજદાર(રો)ને અનુરોધ કરવામાંઆવે છે. લોનના બાકી લેણાની પરત ચુકવણી માટે જામીનગીરી તરીકે નિમ્નલિખિત મિલકતો અનુક્રમે કથિત કરજદાર(રો) દ્વારા એએચએફએલને ગીરો મકવામાં આવેલી છે.

	ક્રમ નં.	કરજદાર/સહ-કરજદાર અને જામીનદારના નામ	ડીમાંડ નોટીસની તારીખ અનેરકમ	જામીનગીરીકૃત મિલકતો (સ્થાવર મિલકતો)નું વર્ણન				
		(લોન કોડ નં. ૧૭૨૧૦૦૦૦૮૭/ નરોડા શાખા) ઇલિયાસખાન પઠાલ (કરજદાર) યાસમીન ઇલિયાસખાન પઠાણ (સહ-કરજદાર)	૧૧-૦૨-૨૦૨૩ ફા. ૧૫.૬૩.૯૯૯/-	ફ્લેટ નં. સી-એ/૧૫ ૩જો માળ, યુનાઈટેડ એપાર્ટમેંટ કો-ઓપ. હા. સોસાયટી, સરખેજ-અમદાવાદ રોડ, મોજે મકતુમપુરા અમદાવાદ, ગુજરાત. ૩૮૦૦૫૫				

બગર કથિત કરજદારો ઉપર જણાવ્યા મુજબ એએચએકએલને ચુકવવા પાત્ર રકમો ચુકવવામાં નિષ્ફળ જશે તો એએચએફએલ સમગ્રપણે કથિત કરજદારોના ખર્ચે બને જોખમે, એક્ટની કલમ ૧૩(૪) હેઠળ ઉપરોક્ત જામીનગીરીકૃત મિલકતો સામે કાર્યવાહી કરશે. ઉપરોક્ત મિલકતોનું, એએચએફએલની લેખિત પૂર્વ સંમતિ ગર વેંચાણ કરવા, ભાડે આપવા કે અન્યથા હસ્તાંતર કરવા પર કથિત કરજદારોને મનાઈ કરવામાં આવે છે. કથિત એક્ટની જોગવાઈઓ અને તે અંતર્ગત કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરનાર કે ઉલ્લંઘન કરવાને ઉત્તેજન આપનાર કોઈપણ વ્યક્તિ આ એક્ટ હેઠળની જોગવાઈઓ અનુસાર કેદ અને/અથવા દંડને પાત્ર રહેશે. સ્થળઃ ગુજરાત સહી/- અધિકૃત અધિકારી આધાર હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ વતી તારીખ:૧૩.૦૨.૨૦૨૩

31.12.2022 Unaudited 31.12.2021 293.61 137.29 (119.14 Net Profit for the period before tax (aft 207.95 158.59 (77.94 13.94 16.04 7.02 ofit/ Loss for the period after compreh 221.89 174.63 (70.92 1068.80 1,068.80 1,068.80 ning Per Share (Of Rs. 10 each) (after extraor

sed in the Company's business and the liabilities contracted are used inter changebly etween segments

1.95

The above results were reviewed by the audit Committee and were approved and taken on record by t ard of Directors in their meeting held on February 11, 2023.

The Company has identified following segments as reportable segment in accordance with Ind AS-108 ied by the ICAI. Segment wise details are given to the extent possible

) Food Processing

nue From Operations includes Export Incentives.

vious Year's figures have been regrouped, reclassified where For & on behalf of the Board of Dir Managing Direct

GOPAL IRON AND STEELS COMPANY (GUJARAT) LIMITED CIN: L27101GJ1994PLC022876

B-701, Nirman Complex, B/h, Navrangpura Bus Stand, Ahmedababd - 380009 GJ IN EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED ON 31/12/2022 (Rs. in Lacs)

Si		Quarter ended on	For the 9 Months ended on	Corresponding 3 Months ended in the previous year
		31/12/2022	31/12/2022	31/12/2021
2	Total Income from Operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or	39.49	56.63	00
3	Extraordinary items) Net Profit / (Loss) for the period	0.6	5.43	(2.06)
75	before Tax (after Exceptional and/or Extraordinary items)	0.60	5.43	(2.06)
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	0.60	5.43	(2.06)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other		Society	750700.27
	Comprehensive Income (after tax)]	0.60	5.43	(2.06)
6	Equity Share Capital	491.71	491.71	491.71
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited	(400.00)	(400.00)	(400.00)
8	Balance Sheet of Previous Year) Earnings Per Share (of Rs.10/-each) (for continuing and discontinued operations)	(408.89)	(408.89)	(408.89)
	- Basic	0.36	0.43	2.07
	- Diluted	0.36	0.43	2.07

Notes: (1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEB (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Forma of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.gopaliron.com) (2) The result of the Quarter ended on 31st December, 2022 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting hel on 11th February, 2023.

By Order of the Board of Directors For, Gopal Iron and Steels Company (Gujarat) Limite sd/- Ms. Kundanben Bhaveshbhai Patel Managing Director - DIN: 03063504 Place: Ahmedabad Date: 11/02/2023



H-106, Phase IV, G.I.D.C., Vithal Udyognagar - 388121. Via Anand, Gujarat.

HLE Glascoat Limited

આધાર હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

CIN: L26100GJ1991PLC016173 Website: www.hleglascoat.com

Extract of Statement of Un-Audited Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2022 (Rs. In Lacs except EPS)

તારીખઃ ૧૩.૦૨.૨૦૨૩

	Particulars	Standalone						Consolidated					
Sr. No.		Quarter Ended			Nine Months Ended		Year Ended	Quarter Ended		Nine Months Ended		Year Ended	
		31.12.22	30.09.22	31.12.21	31.12.22	31.12.21	31.03.22	31.12.22	30.09.22	31.12.21	31.12.22	31.12.21	31.03.22
		UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED
1	Total Income from Operation (net)	15,048.95	14,701.46	12,854.89	43,836.72	35,089.63	50,848.93	21,422.88	21,452.80	15,473.66	63,318.03	40,299.03	65,221.82
3	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items*)	1,122.78	1,472.96	2,304.95	4,361.88	6,069.92	8,096.85	1,734.68	2,760.38	2,360.35	6,676.82	6,290.89	9,342.70
	Net Profit/ (Loss) for the period before Tax, (after Exceptional and / or Extraordinary items*)	1,122.78	1,472.96	2,304.95	4,361.88	6,069.92	8,096.85	1,734.68	2,760.38	1,519.18	6,676.82	5,449.72	8,431.28
	Net Profit/ (Loss) for the period after Tax, (after Exceptional and / or Extraordinary items*)	813.82	1,089.70	1,683.80	3,205.74	4,413.23	6,176.48	1,227.46	1,936.58	775.50	4,701.85	3,497.22	5,823.34
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (loss) for period (after tax) and Other Comprehensive Income (after tax)]	808.22	1,085.29	1,673.88	3,191.87	4,383.46	6,215.08	2,509.65	1,610.88	502.26	5,364.46	3,204.13	5,769.52
6	Equity Share Capital	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.		-	-	-	-	-	-	-	-	-	-	-
	Earning Per Share (of Rs 2/- each)												
	a.(from continuing operations) Basic	1.15	1.69	2.46	4.84	6.65	9.40	1.76	2.93	1.13	7.03	5.31	8.89
8	Diluted	1.15	1.69	2.46	4.84	6.65	9.40	1.76	2.93	1.13	7.03	5.31	8.89
	b.(from discontinuing operations) Basic	0.04	(0.09)	0.01	(0.15)	(0.18)	(0.36)	0.04	(0.09)	0.01	(0.15)	(0.18)	(0.36)
	Diluted	0.04	(0.09)	0.01	(0.15)	(0.18)	(0.36)	0.04	(0.09)	0.01	(0.15)	(0.18)	(0.36)
NOTES:													

Date: 11th February, 2023

Place: Maroli

The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly and nine months financial results are available on the websites of the Stock Exchange (s): www.bseindia.com, www.nseindia.com and the Company: www.hleglascoat.com and the Compan

The Board of Directors has resolved for the closure and winding down of the Chemical Business operations. The performance of the discontinuing operations included in the above results for the nine months

ended 31st December, 2022 are as follows: Total income: Rs. 605.2 lakhs, Expenses: Rs. 704.33 lakhs, Loss: Rs. 99.13 lakhs, Assets: Rs. 1440.17 lakhs, Liabilities: Rs. 100.58 lakhs

For HLE Glascoat Limited

Sd/-

Himanshu Patel **Managing Director**

















